

## સ્યાદ્વાદ દ્વાર

(૧૧)

સ્વામી અમૃતચંદ્ર મુનિની પ્રતિફા (ચોપાઈ)  
 અદ્ભુત ગ્રંથ અધ્યાત્મ વાની ।  
 સમુજ્ઝે કોઊ વિરલા ગ્યાની ॥  
 યામે સ્યાદવાદ અધિકારા ।  
 તાકૌ જો કીજૈ બિસતારા ॥૧॥  
 તો ગરથં અતિ સોભા પાવૈ ।  
 વહ મંદિર યહુ કલસ કહાવૈ ॥  
 તવ ચિત અમૃત વચન ગઠિ ખોલે ।  
 અમૃતચંદ્ર આચારજ બોલે ॥૨॥

શાલાર્થ :—અદ્ભુત=અથાડ, બિરલા=કોઈ કોઈ. ગઠિ=રચીને.

અર્થ :—આ અધ્યાત્મ-કથનનો ગણન ગ્રન્થ છે, એને કોઈ વિરલા મનુષ્ય જ સમજ શકે છે. જો એમાં સ્યાદ્વાદ અધિકાર વધારવામાં આવે તો આ ગ્રંથ અત્યંત સુંદર થઈ જાય, અર્થાત્ જો કુંદકુંદસ્વામી રચિત ગ્રન્થની રચના મંદિરવત્ છે, તો તેના ઉપર સ્યાદ્વાદનું કથન કળશ સમાન સુશોભિત થશે. એવો વિચાર કરીને અમૃત-વચનોની રચના કરીને અમૃતચંદ્ર સ્વામી કહે છે. ૧. ૨.

વળી— (દોહરા)

કુંદકુંદ નાટક વિષે, કહ્યો દરબ અધિકાર ।  
 સ્યાદવાદ નૈ સાધિ મૈં, કહોં અવસ્થા દ્વાર ॥૩॥  
 કહોં મુકતિ-પદકી કથા, કહોં મુકતિકૌ પંથ ।  
 જૈસેં ધૃત કારજ જહાં, તહાં કારન દધિ મંથ ॥૪॥

**અર્થ :**—સ્વામી કુન્દકુન્દાચાર્યે નાટક ગ્રન્થમાં જીવ-અજીવ દ્રવ્યોનું સ્વરૂપ વર્ણવ્યું છે, હવે હું સ્યાદ્વાદ, નય અને સાધ્ય-સાધક અધિકાર કહું છું. ત. સાધ્ય-સ્વરૂપ મોક્ષપદ અને સાધક-સ્વરૂપ મોક્ષમાર્ગનું કથન કરું છું. જેવી રીતે ધી-રૂપ પદાર્થની પ્રાપ્તિ માટે દહીં વલોવવું તે કારણ છે. ૪.

**ભાવાર્થ :**—જેવી રીતે દધિમંથનરૂપ કારણ મળવાથી ધૂત પદાર્થની પ્રાપ્તિરૂપ કાર્ય સિદ્ધ થાય છે, તેવી જ રીતે મોક્ષમાર્ગનું ગ્રહણ કરવાથી મોક્ષપદાર્થની પ્રાપ્તિ થાય છે. મોક્ષમાર્ગ કારણ છે અને મોક્ષપદાર્થ કાર્ય છે. કારણ વિના કાર્યની સિદ્ધિ થતી નથી, તેથી કારણસ્વરૂપ મોક્ષમાર્ગ અને કાર્યસ્વરૂપ મોક્ષ બન્નેનું વર્ણન કરવામાં આવે છે.

(ચોપાઈ)

અમૃતચંદ્ર બોલે મૂદુવાની ।  
 સ્યાદવાદકી સુનૌ કહાની ॥  
 કોઊ કહૈ જીવ જગ માંહી ।  
 કોઊ કહૈ જીવ હૈ નાંહી ॥૫॥

(દોદરા)

એકરૂપ કોઊ કહૈ, કોઊ અગનિત અંગ ।  
 છિનભંગુર કોઊ કહૈ, કોઊ અભંગ ॥૬॥  
 ને અનંત ઇહવિધિ કહી, મિલૈ ન કાહૂ કોઈ ।  
 જો સબ ને સાધન કરૈ, સ્યાદવાદ હૈ સોઈ ॥૭॥

**શાલાર્થ :**—કહાની=કથન. અગનિત અંગ=અનેક રૂપ. છિનભંગુર=અનિત્ય. અભંગ=નિત્ય.

**અર્થ :**—અમૃતચંદ્ર સ્વામીએ મૂદુ વચ્ચેનોમાં કહ્યું કે સ્યાદ્વાદનું કથન સાંભળો; કોઈ કહે છે કે સંસારમાં જીવ છે, કોઈ કહે છે કે જીવ નથી. પ. કોઈ જીવને એકરૂપ અને કોઈ અનેકરૂપ કહે છે, કોઈ જીવને અનિત્ય અને કોઈ નિત્ય કહે છે. હ. આ રીતે અનેક નય છે, કોઈ કોઈમાં મળતા નથી, પરસ્પર વિરુદ્ધ છે એ જે સર્વ નયોને સાધે છે તે સ્યાદ્વાદ છે. ૭.

વિશેષ—કોઈ જીવ પદાર્�ને અસ્તિસ્વરૂપ અને કોઈ જીવ પદાર્થને નાસ્તિસ્વરૂપ કહે છે. અદ્વૈતવાદી જીવને એક બ્રહ્મરૂપ કહે છે, નૈયાયિક જીવને અનેકરૂપ કહે છે. બૌદ્ધમતવાળા જીવને અનિત્ય કહે છે, સાંખ્યમતવાળા શાશ્વત અર્થાત् નિત્ય કહે છે અને આ સર્વ પરસ્પર વિરુદ્ધ છે, કોઈ કોઈને મળતા નથી, પણ સ્યાદ્વાદી સર્વ નયોને અવિરુદ્ધ સાધે છે.

સ્યાદ્વાદ સંસાર-સાગરથી તારનાર છે (દોહરા)

સ્યાદવાદ અધિકાર અબ, કહો જૈનકૌ મૂલ ।

જાકે જાનત જગત-જન, લહૈ જગત-જલ-કૂલ ॥૮॥

શાદ્વાર્ય :—મૂલ=મુખ્ય. જગત-જન=સંસારના મનુષ્ય. ઝૂલ=કિનારો.

અર્થ :—જૈનમતનો મૂળ સિદ્ધાંત ‘સ્યાદ્વાદ અધિકાર’ કહું છું, જેનું જ્ઞાન થવાથી જગતના મનુષ્ય સંસાર-સાગરથી પાર થાય છે. ૮.

નય સમૂહ વિષે શિષ્યની શંકા અને ગુરુનું સમાધાન (સવૈયા એકગ્રીસા)

શિષ્ય કહૈ સ્વામી જીવ સ્વાધીન કિ પરાધીન,

જીવ એક હૈ કિથોં અનેક માનિ લીજિએ ।

જીવ હૈ સદીવ કિથોં નાંહી હૈ જગત માંહિ,

જીવ અવિનશ્બર કિ નશ્બર કહીજિએ ॥

સતગુર કહૈ જીવ હૈ સદીવ નિજાધીન,

એક અવિનશ્બર દરવ-દ્રિષ્ટિ દીજિએ ।

જીવ પરાધીન છિનભંગુર અનેક રૂપ,

નાંહી જહાં તહાં પરજૈ પ્રવાન કીજિએ ॥૯॥

અત્ર સ્યાદ્વાદશુદ્ધ્યર્થ વસુતત્ત્વવ્યવસ્થિતિः ।

ઉપાયોપેયભાવશ્ચ મનાંભૂયોऽપિ ચિન્યતે ॥૧॥

બાદ્યાર્થે: પરિપીતમુજ્જીતનિજગ્રબ્ધક્રિરિક્તીભવદ્

વિશ્રાન્ત પરરૂપ એવ પરિતો જ્ઞાન પશો: સીદતિ ।

યત્તત્તત્તદિહ સ્વરૂપત ઇતિ સ્યાદ્વાદિનસ્તત્યુન-

રૂરોન્મગનધનસ્વભાવભરતઃ પૂર્ણ સમુન્મજ્ઞતિ ॥૧॥

**શાલાર્થ :**—અવિનશ્બર=નિત્ય. નશ્બર=અનિત્ય. નિજાધીન=પોતાને આધીન. પરાધીન=બીજાને આધીન. નાહી=નાનાર.

**અર્થ :**—શિષ્ય પૂછે છે કે હે સ્વામી! જગતમાં જીવ સ્વાધીન છે કે પરાધીન? જીવ એક છે અથવા અનેક? જીવ સદાકાળ છે અથવા કોઈવાર જગતમાં નથી રહેતો? જીવ અવિનાશી છે અથવા નાશવાન છે? શ્રીગુરુ કહે છે કે દ્રવ્યદૃષ્ટિથી જુઓ તો જીવ સદાકાળ છે, સ્વાધીન છે, એક છે અને અવિનાશી છે. પર્યાયદૃષ્ટિએ પરાધીન, ક્ષણાભંગુર, અનેકરૂપ અને નાશવાન છે, તેથી જ્યાં જે અપેક્ષાએ કહેવામાં આવ્યું હોય તેને પ્રમાણ કરવું જોઈએ.

**વિશેષ :**—જ્યારે જીવની કર્મરહિત શુદ્ધ અવસ્થા ઉપર દૃષ્ટિ મૂકવામાં આવે છે ત્યારે તે સ્વાધીન છે, જ્યારે તેની કર્માધીન દશા ઉપર ધ્યાન આપવામાં આવે છે, ત્યારે તે પરાધીન છે. લક્ષણની દૃષ્ટિએ સર્વ જીવદ્રવ્ય એક છે, સંખ્યાની દૃષ્ટિએ અનેક છે. જીવ હતો, જીવ છે, જીવ રહેશે, એ દૃષ્ટિએ જીવ સદાકાળ છે, જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે, તેથી એક ગતિમાં સદાકાળ નથી. જીવ પદાર્થ કદી નાનાર જતો નથી, તેથી તે અવિનાશી છે, ક્ષણે-ક્ષણે પરિણામન કરે છે તેથી તે અનિત્ય છે. ૮.

પદાર્થ સ્વ-ચતુષ્ટયની અપેક્ષાએ અસ્તિત્વ અને પર-ચતુષ્ટય અપેક્ષાએ નાસ્તિત્વ છે.

(સવૈયા એકત્રીસા)

દર્વ ખેત કાલ ભાવ ચ્યારોં ભેદ વસ્તુહીમેં,

અપને ચતુષ્ક વસ્તુ અસ્તિત્વ માનિયૈ।

પરકે ચતુષ્ક વસ્તુ નાસતિ નિયત અંગ,

તાકો ભેદ દર્વ-પરજાઇ મધ્ય જાનિયૈ॥

દરવ તો વસ્તુ ખેત સત્તાભૂમિ કાલ ચાલ,

સ્વભાવ સહજ મૂલ સકતિ બખાનિયૈ।

યાહી ભાંતિ પર વિકલપ બુદ્ધિ કલપના,

વિવહારદ્રિષ્ટિ અંસ ભેદ પરવાંનિયૈ॥૧૦॥

શાલાર્થ :—ચતુષ્ક=ચાર. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ. અસ્તિ=ઇ. નાસ્તિ=નથી.  
નિયત=નિશ્ચય. પરજાહી=અવસ્થા. સત્તાભૂમિ=ક્ષેત્રાવગાહ.

**અર્થ :**—દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ ચારે વસ્તુમાં જ છે, તેથી પોતાના ચતુષ્ક અર્થાત્ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવની અપેક્ષાએ વસ્તુ અસ્તિસ્વરૂપ છે અને પરચતુષ્ક અર્થાત્ પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવની અપેક્ષાએ વસ્તુ નાસ્તિસ્વરૂપ છે. આ રીતે નિશ્ચયથી દ્રવ્ય અસ્તિ-નાસ્તિસ્વરૂપ છે. તેમના ભેદ દ્રવ્ય અને પરચાયમાં જાણી શકાય છે. વસ્તુને દ્રવ્ય, સત્તાભૂમિને ક્ષેત્ર, વસ્તુના પરિણામનને કાળ અને વસ્તુના મૂળ સ્વભાવને ભાવ કહે છે. આ રીતે બુદ્ધિથી સ્વચતુષ્ટય અને પરચતુષ્ટયની કલ્પના કરવી તે વ્યવહારનો ભેદ છે.

**વિશેષ :**—ગુણ-પર્યાયોના સમૂહને વસ્તુ કહે છે, એનું જ નામ દ્રવ્ય છે. પદાર્થ આકાશના જે પ્રદેશઓને રોકીને રહે છે અથવા જે પ્રદેશોમાં પદાર્થ રહે છે, તે સત્તાભૂમિને ક્ષેત્ર કહે છે. પદાર્થના પરિણામન અર્થાત્ પર્યાયથી પર્યાયાન્તર થવું તેને કાળ કહે છે. અને પદાર્થના નિજસ્વભાવને ભાવ કહે છે. આ જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પદાર્થનું ચતુષ્ક અથવા ચતુષ્ટય કહેવાય છે. આ પદાર્થનું ચતુષ્ટય સદા પદાર્થમાં જ રહે છે, તેનાથી લિત્ર થતું નથી. જેમકે-ઘટમાં સ્પર્શ, રસ, અથવા રૂક્ષ, કઠોર, રક્ત આદિ ગુણ-પર્યાયોનો સમુદ્દરાય દ્રવ્ય છે, જે આકાશના પ્રદેશોમાં ઘટ સ્થિત છે અથવા ઘટના પ્રદેશો તેનું ક્ષેત્ર છે, ઘટના ગુણ-પર્યાયોનું પરિવર્તન તેનો કાળ છે, ઘટની જળધારણાની શક્તિ તેનો ભાવ છે. એવી જ રીતે પટ પણ એક પદાર્થ છે, ઘટની જેમ પટમાં પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ છે. ઘટના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ ઘટમાં છે, પટમાં નથી; તેથી ઘટ પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અસ્તિસ્વરૂપ છે અને પટના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી નાસ્તિસ્વરૂપ છે. એવી જ રીતે પટના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પટમાં છે, તેથી પટ પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અસ્તિસ્વરૂપ છે, પટના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ઘટમાં નથી, તેથી પટ, ઘટના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી નાસ્તિસ્વરૂપ છે. ૧૦.

સ્યાદ્વાદના સાત ભંગા (દોહરા)

હૈ નાંહી નાંહી સુ હૈ, હૈ હૈ નાંહી નાંહી।  
યહ સરવંગી નય ધની, સબ માનૈ સવમાંહિ ॥૧૧॥

**શાલાર્થ :**—હૈ=છે. નાંહી=નથી. હૈ નાંહી=છે—નથી. નાંહી સુ હૈ=અવકતવ્ય.

**અર્થ :**—અસ્તિ, નાસ્તિ, અસ્તિ—નાસ્તિ, અવકતવ્ય, અસ્તિ અવકતવ્ય, નાસ્તિ અવકતવ્ય અને અસ્તિ-નાસ્તિ અવકતવ્ય. આવી રીતે સાત ભંગ થાય છે. એને સર્વાંગ નયના સ્વામી સ્વાધ્યાદ સર્વ વસ્તુમાં માને છે.

**વિશેષ :**—સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવ આ પોતાના ચતુષ્ટયની અપેક્ષાએ તો દ્રવ્ય અસ્તિસ્વરૂપ છે. અર્થાત્ પોતા સમાન છે. પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવ આ પરચતુષ્ટયની અપેક્ષાએ દ્રવ્ય નાસ્તિસ્વરૂપ છે અર્થાત્ પરસમાન નથી. ઉપર્યુક્ત સ્વચતુષ્ટય પર ચતુષ્ટયની અપેક્ષાએ કુમથી ગ્રણે કાળે પોતાના ભાવોથી અસ્તિ-નાસ્તિ સ્વરૂપ છે અર્થાત્ પોતા સમાન છે—પરસમાન નથી. અને સ્વચતુષ્ટયની અપેક્ષાએ દ્રવ્ય એક જ કાળે વચ્ચનગોચર નથી, આ કારણે અવકતવ્ય છે અર્થાત્ કહેવામાં આવી શકતું નથી. અને તે જ સ્વચતુષ્ટયની અપેક્ષાએ અને એક જ કાળે સ્વ-પર ચતુષ્ટયની અપેક્ષાએ દ્રવ્ય અસ્તિસ્વરૂપ છે તોપણ અવકતવ્ય છે. અને તે જ દ્રવ્ય પરચતુષ્ટયની અપેક્ષાએ નાસ્તિસ્વરૂપ છે તોપણ કહી શકતું નથી. અને તે જ દ્રવ્ય સ્વચતુષ્ટયની અપેક્ષાએ અને પરચતુષ્ટયની અપેક્ષાએ અને એક જ કાળે સ્વપરચતુષ્ટયની અપેક્ષાએ આસ્તિ-નાસ્તિસ્વરૂપ છે, તોપણ અવકતવ્ય છે. જેમકે—એક જ પુરુષ પુત્રની અપેક્ષાએ પિતા કહેવાય છે અને તે જ પુરુષ પોતાના પિતાની અપેક્ષાએ પુત્ર કહેવાય છે. તે જ પુરુષ મામાની અપેક્ષાએ ભાણેજ કહેવાય છે અને ભાણેજની અપેક્ષાએ મામા કહેવાય છે, સ્ત્રીની અપેક્ષાએ પતિ કહેવાય છે, બહેનની અપેક્ષાએ ભાઈ કહેવાય છે તથા તે જ પુરુષ પોતાના વેરીની અપેક્ષાએ શત્રુ કહેવાય છે અને ઈષ્ટની અપેક્ષાએ મિત્ર પણ કહેવાય છે. ઈત્યાદિ અનેક સંબંધોથી એક જ પુરુષ કર્થંચિત્ અનેક પ્રકારે આવે છે, તેવી જ રીતે એક દ્રવ્ય સાત ભંગ દ્વારા સાધવામાં આવે છે. આ સાત ભંગોનું વિશેષ સ્વરૂપ સમભંગીતરંગિણી આદિ અન્ય ફૈનશાઓમાંથી સમજવું જોઈએ. ૧૧.

એકાન્તાદીઓના ચૌદ નય-ભેદ

(સવૈયા એકત્રીસા)

ગ્યાનકૌ કારન જ્ઞેય આત્મા ત્રિલોકમય,  
જ્ઞેયસૌં અનેક ગ્યાન મેલ જ્ઞેય છાંહી હૈ।

જૌલોં જ્ઞેય તૌલોં ગ્યાન સર્વ દર્વમેં વિગ્યાન,  
 જ્ઞેય ક્ષેત્ર માન ગ્યાન જીવ વસ્તુ નાંહી હૈ॥  
 દેહ નસૈ જીવ નસૈ દેહ ઉપજત લસૈ,  
 આત્મા અચેતના હૈ સત્તા અંસ માંહી હૈ।  
 જીવ છિનભંગુર અગ્યાયક સહજરૂપી<sup>૧</sup> ગ્યાન,  
 એસી એસી એકાન્ત અવસ્થા મૂઢ પાંહી હૈ॥૧૨॥

અર્થ :—(૧) શેય, (૨) ત્રૈલૌક્યમય, (૩) અનેક જ્ઞાન, (૪) શેયનું પ્રતિબિભિ, (૫) શેય કાળ, (૬) દ્રવ્યમય જ્ઞાન, (૭) ક્ષેત્રયુત જ્ઞાન, (૮) જીવ નાસ્તિ, (૯) જીવ વિનાશ, (૧૦) જીવ ઉત્પાદ, (૧૧) આત્મા અચેતન, (૧૨) સત્તા અંશ, (૧૩) ક્ષાણભંગુર, (૧૪) અગ્યાયક. આવી રીતે ચોદ નય છે. જે કોઈ એક નયનું ગ્રહણ કરે અને બાકીનાને છોડે, તે એકાન્તી મિથ્યાદાષ્ટિ છે.

- (૧) શેય—એક પક્ષ એ છે કે જ્ઞાન માટે શેય કારણ છે.
- (૨) ત્રૈલૌક્ય પ્રમાણ—એક પક્ષ એ છે કે આત્મા ત્રણલોક બરાબર છે.
- (૩) અનેક જ્ઞાન—એક પક્ષ એ છે કે જ્ઞેયમાં અનેકતા હોવાથી જ્ઞાન પણ અનેક છે. *આનંદ.*
- (૪) શેયનું પ્રતિબિભિ—એક પક્ષ એ છે કે જ્ઞાનમાં શેય પ્રતિબિભિત થાય છે.
- (૫) શેય કાળ—એક પક્ષ એ છે કે જ્યાં સુધી શેય છે ત્યાંસુધી જ્ઞાન છે, શેયનો નાશ થવાથી જ્ઞાનનો પણ નાશ છે.
- (૬) દ્રવ્યમય જ્ઞાન—એક પક્ષ એ છે કે સર્વ દ્રવ્ય બ્રહ્મથી અભિન્ન છે, તેથી બધા પદાર્થો જ્ઞાનરૂપ છે.
- (૭) ક્ષેત્રયુત જ્ઞાન—એક પક્ષ એ છે કે જ્ઞેયના ક્ષેત્ર બરાબર જ્ઞાન છે એનાથી બહાર નથી.
- (૮) જીવ નાસ્તિ—એક પક્ષ એ છે કે જીવ પદાર્થનું અસ્તિત્વ જ નથી.

૧. ‘સુરૂપી જ્ઞાન’ અવો પણ પાઠ છે.

- (૯) જીવ વિનાશ—એક પક્ષ એ છે કે દેહનો નાશ થતાં જ જીવનો નાશ થઈ જાય છે.
- (૧૦) જીવ ઉત્પાદ—એક પક્ષ એ છે કે શરીરની ઉત્પત્તિ થતાં જીવની ઉત્પત્તિ થાય છે.
- (૧૧) આત્મા અચેતન—એક પક્ષ એ છે કે આત્મા અચેતન છે, કેમકે જ્ઞાન અચેતન છે.
- (૧૨) સત્તા અંશ—એક પક્ષ એ પણ છે કે આત્મા સત્તાનો અંશ છે.
- (૧૩) ક્ષાળભંગુર—એક પક્ષ એ છે કે જીવનું સદા પરિણામન થાય છે તેથી ક્ષાળભંગુર છે.
- (૧૪) અજ્ઞાયક—એક પક્ષ એ છે કે જ્ઞાનમાં જીવાની શક્તિ નથી, તેથી અજ્ઞાયક છે. ૧૪

પ્રથમ પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન  
(સર્વૈયા એકત્રીસા)

કોઊ મૂઢ કહૈ જૈસેં પ્રથમ સવારી ભીંતિ,  
પાછેં તાકે ઊપર સુચિત્ર આછયૌ લેખિએ ।  
તૈસેં મૂલ કારન પ્રગટ ઘટ પટ જૈસૌ,  
તૈસૌ તહાં ગ્યાનરૂપ કારજ વિસેખિએ ॥  
ગ્યાની કહૈ જૈસી વસ્તુ તૈસૌ હી સુભાવ તાકૌ,  
તાતેં ગ્યાન જ્ઞેય ભિન્ન ભિન્ન પદ પેખિએ ।  
કારન કારજ દોઊ એકહીમેં નિહચૈ પૈ,  
તેરૌ મત સાચૌ વિવહારદૃષ્ટિ દેખિએ ॥૧૩॥

શાલાર્થ :—ભીંતિ=દીવાલ. આછયૌ=ઉત્તમ. મૂલ કારણ=મુખ્ય કારણ-કારજ=કાર્ય.  
નિહચૈ=નિશ્ચયનયથી.

**અર્થ :-**કોઈ અજ્ઞાની(મીમાંસક) આદિ કહે છે કે પહેલાં દીવાલ સાફ કરીને પછી તેના ઉપર ચિત્રકામ કરવાથી ચિત્ર સારું થાય છે અને જો દીવાલ ખરાબ હોય તો ચિત્ર પણ ખરાબ ઉઘડે છે; તેવી જ રીતે જ્ઞાનના મૂળ કારણ ઘટ-પટ આદિ જોય જેવા હોય છે તેવું જ્ઞાનરૂપ કાર્ય થાય છે, તેથી સ્પષ્ટ છે કે જ્ઞાનનું કારણ જોય છે, અને સ્યાદ્વાદી જ્ઞાની સંબોધન કરે છે કે જે જેવો પદાર્થ હોય છે, તેવો જ તેનો સ્વભાવ હોય છે, તેથી જ્ઞાન અને જોય બિન્ન-બિન્ન પદાર્થ છે. નિશ્ચયનયથી કારણ અને કાર્ય બસે એક જ પદાર્થમાં છે, તેથી તારું જે મંતવ્ય છે તે વ્યવહારનયથી સત્ય છે. ૧૩.

બીજા પક્ષનાં સ્પષ્ટીકરણ અને ખંડન

(સવૈયા એકબ્રીસા)

કોઊ મિથ્યામતી લોકાલોક વ્યાપી ગ્યાન ગાનિ,  
સમુજ્જૈ ત્રિલોક પિંડ આતમ દરબ હૈ।  
યાહીતે સુછંદ ભયૌ ડોલૈ મુખહૂ ન બોલૈ,  
કહૈ યા જગતમૈ હમારોઈ પરબ હૈ॥  
તાસો ગ્યાતા કહૈ જીવ જગતસો ભિન્ન પૈ,  
જગતકૌ વિકાસી તોહી યાહીતે ગરબ હૈ।  
જો વસ્તુ સો વસ્તુ પરરૂપસો નિરાલી સદા,  
નિહચૈ પ્રમાન સ્યાદવાદમૈ સરબ હૈ॥૧૪॥

**શાન્દાર્થ :-**લોક=જ્યાં છ દ્રવ્ય પ્રાપ્ત થાય. અલોક=લોકથી બહારનું ક્ષેત્ર. સુછંદ=સ્વતંત્ર. ગરબ=અભિમાન.

**અર્થ :-**કોઈ અજ્ઞાની (નૈયાપિક આદિ) જ્ઞાનને લોકાલોક વ્યાપી જાણીને

વિશ્વ જ્ઞાનમિતિ પ્રતર્કર્ય સકલાં દૃષ્ટ્વા સ્વતત્ત્વાશયા  
ભૂત્વા વિશ્વમય: પશુ: પશુરિવ સ્વચ્છન્દમાચેષ્ટતે।  
યત્તત્તત્પરરૂપતો ન તદિતિ સ્યાદ્વાદર્શી પુન-  
વિશ્વાદ્વિન્નમવિશ્વવિશ્વઘટિતં તસ્� સ્વતત્ત્વં સૃશેત् ॥૩॥

આત્મ-પદાર્થને તૈલોક્ય-પ્રમાણ સમજું બેઠા છે, તેથી પોતાને સર્વવ્યાપી સમજુને સ્વતંત્ર વર્તે છે; અને અભિમાનમાં મસ્ત થઈને બીજાને મૂર્ખ સમજે છે, કોઈની સાથે વાત પણ કરતા નથી અને કહે છે કે સંસારમાં અમારો જ સિદ્ધાંત સાચો છે. તેમને સ્યાદ્વાદી કહે છે કે જીવ જગતથી જુદ્દો છે, પરંતુ તેનું જ્ઞાન ત્રણ લોકમાં પ્રસારિત થાય છે તેથી તને ઈશ્વરપણાનું અભિમાન છે, પરંતુ પદાર્થ પોતાના સિવાય અન્ય પદાર્થોથી નિરાળો રહે છે. તેથી નિશ્ચયનયથી સ્યાદ્વાદમાં સર્વ ગર્ભિત છે. ૧૪.

તૃતીય પક્ષનનું સ્પષ્ટીકરણ અને ખંડન

(સવૈયા એકત્રીસા)

કોઝ પસુ ગ્યાનકી અનંત વિચિત્રાઈ દેખૈ,  
જ્ઞેયકે અકાર નાનારૂપ વિસતરયૌ હૈ।  
તાહીકો વિચાર કહૈ ગ્યાનકી અનેક સત્તા,  
ગહિકૈ એકંત પછ્છ લોકનિસોં લર્યૌ હૈ॥  
તાકૌ બ્રમ ભંજિવેકૌ ગ્યાનવંત કહૈ ગ્યાન,  
અગમ અગાધ નિરાબાધ રસ ભર્યૌ હૈ।  
જ્ઞાયક સુભાડું પરજાયસોં અનેક ભયૌ,  
જયપિ તથાપિ એકતાસોં નહિ ટર્યૌ હૈ॥૧૯૫॥

શાસ્ત્રાર્થ :—પસુ=મૂર્ખ. વિસતરયૌ=ફેલાયો. લર્યૌ=જગડે છે ભંજિવેકૌ=નાના કરવાને માટે.

અર્થ :—અનંત જ્ઞેયના આકારરૂપ પરિણમન કરવાથી જ્ઞાનમાં અનેક વિચિત્રતાઓ દેખાય છે, તેનો વિચાર કરીને કોઈ કોઈ પશુવત્ત અજ્ઞાની કહે છે કે જ્ઞાન

બાહ્યાર્થગ્રહણસ્વભાવભરતો                  વિષ્વગ્રિચિત્રોલ્લસ-  
જ્ઞેયકારવિશીર્ણશક્તિરભિતસ્મુદ્યન્યશુર્નશ્યતિ ।  
એકદ્રવ્યતયા      સદાયુદિતયા      ભેદભ્રમ      ધ્વંસય-  
નેકં જ્ઞાનમગાધિતાનુભવનં      પશ્યત્વનેકાન્તવિત् ॥૪॥

અનેક છે અને એનો એકાંત પક્ષ ગ્રહણ કરીને લોકો સાથે જગડે છે. તેમનું અજ્ઞાન દૂર કરવા માટે સ્યાદ્વાદી કહે છે કે જ્ઞાન અગમ્ય, ગંભીર અને નિરાભાધ રસથી પરિપૂર્ણ છે. તેનો જ્ઞાયકસ્વભાવ છે, તે જોકે પર્યાયદિષ્ટિ અનેક છે, તોપણ દ્વયદિષ્ટિ એક જ છે. ૧૫.

ચતુર્થ પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન

(સવૈયા એકત્રીસા)

કોઊ કુધી કહૈ ગ્યાન માંહિ જ્ઞેયકૌ અકાર,  
પ્રતિભાસિ રહ્યૌ હૈ કલંક તાહિ ધોઇયૈ ।  
જબ ધ્યાન જલસોં પખારિકૈ ધવલ કીજૈ,  
તવ નિરાકાર સુદ્ધ ગ્યાનમય હોઇયૈ ॥  
તાસોં સ્યાદવાદી કહૈ ગ્યાનકૌ સુભાઉ યૈ,  
જ્ઞેયકૌ અકાર વસ્તુ માંહિ કહાં ખોઇયૈ ।  
જૈસે નાનારૂપ પ્રતિબિંબકી ઝલક દીખૈ,  
જયપિ તથાપિ આરસી વિમલ જોઇયૈ ॥૧૬॥

શાલાર્થ :- કુધી=મૂર્ખ. પ્રતિભાસ=જળકળું. કલંક=દોષ. પખારિકૈ=ધોઈને. ધવલ=ઉજ્જવલ. આરસી=દર્પણાય જોઈયૈ=દેખીએ.

અર્થ :- કોઈ અજ્ઞાની કહે છે કે જ્ઞાનમાં જ્ઞેયનો આકાર જળકે છે, એ જ્ઞાનનો દોષ છે, જ્યારે ધ્યાનરૂપ જળથી જ્ઞાનનો આ દોષ ધોઈને સાફ કરવામાં આવે ત્યારે શુદ્ધ જ્ઞાન નિરાકાર થાય છે. તેને સ્યાદ્વાદી જ્ઞાની કહે છે કે જ્ઞાનનો એવો જ સ્વભાવ છે, જ્ઞેયનો આકાર જે જ્ઞાનમાં જળકે છે, તે ક્યાંથી કાઢી મુકાય ? જેવી રીતે દર્પણમાં જો કે અનેક પદાર્થો પ્રતિબિભિત થાય છે; તોપણ દર્પણ જેમનું તેમ સ્વચ્છ જ બની

જ્ઞેયાકારકલંકમેચકવિતિ પ્રકાલન કલ્પય-  
નેકાકારચિકીર્ષય સુફટમણિ જ્ઞાન પશુર્નેછતિ ।  
વૈચિત્રેયવિચિત્રતામુપગતં જ્ઞાન સ્વતઃકાલિતં  
પર્યાયસ્તદનેકતાં પરિમૃશન् પશ્યત્વનેકાન્તવિત् ॥૫॥

રહે છે, તેમાં કાંઈ પણ વિકાર થતો નથી. ૧૬.

પંચમ પદ્ધતિનું સ્પષ્ટીકરણ અને ખંડન

(સવૈયા એકત્રીસા)

કોઝ અજ્ઞ કહૈ જ્ઞેયાકાર ગ્યાન પરિનામ,  
જૌલોં વિદ્યમાન તૌલોં ગ્યાન પરગટ હૈ।  
જ્ઞેયકે વિનાસ હોત ગ્યાનકૌ વિનાસ હોઇ,  
એસી વાકે હિરદૈ મિથ્યાતકી અલટ હૈ॥  
તાસૌં સમકિતવંત કહૈ અનુભૌ કહાનિ,  
પર્જય પ્રવાંન ગ્યાન નાનાકાર નટ હૈ।  
નિરવિકલપ અવિનસ્વર દરબરુસ્પ,  
ગ્યાન જ્ઞેય વસ્તુસૌં અવ્યાપક અઘટ હૈ॥૧૭॥

**શાખાર્થ :**—અજ્ઞ=અજ્ઞાની. વિદ્યમાન=મોજૂદ. કહાનિ=કથા. પર્જય પ્રવાંન=પર્યાય જેવણું. નાનાકાર=અનેક આકૃતિ. અવ્યાપક=અનેકમેક નહિ થનાર. અઘટ=ઘટતી નથી અર્થાત્ બેસતી નથી.

**અર્થ :**—કોઈ કોઈ અજ્ઞાની કહે છે કે જ્ઞાનનું પરિણમન જોયના આકારે થાય છે, જ્યાં સુધી જોય વિદ્યમાન રહે છે ત્યાંસુધી જ્ઞાન પ્રગટ રહે છે અને જોયનો વિનાશ થતાં જ જ્ઞાન નષ્ટ થઈ જાય છે, આ રીતે તેના હૃદયમાં મિથ્યાત્વનો દુરાગ્રહ છે. તેથી ભેદવિજ્ઞાની અનુભવની વાત કહે છે કે જેવી રીતે એક જ નટ અનેક સ્વાંગ બનાવે છે, તેવી જ રીતે એક જ જ્ઞાન પર્યાયો-અનુસાર અનેકરૂપ ધારણ કરે છે. વાસ્તવમાં જ્ઞાન નિર્વિકલ્પ અને નિત્ય છે, તે જોયમાં પ્રવેશ નથી કરતું, તેથી જ્ઞાન અને જોયની એકતા ઘટતી નથી. ૧૭.

પ્રત્યક્ષાલિખિતસ્કુટસ્થિરપરદ્વાસ્તિતાવંચિત:

સ્વદ્રવ્યાનવલોકનેન પરિતઃ શૂન્ય: પર્શુર્નશ્યતિ ।

સ્વદ્રવ્યાસ્તિતયા નિરૂપ્ય નિપુણં સદ્ય: સમુન્મજ્ઞતા

સ્થાદ્વાદી તુ વિશુદ્ધબોધમહસા પૂર્ણો ભવન् જીવતિ ॥૬॥

છું પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન (સવૈયા એકગ્રીસા)  
 કોઊ મંદ કહૈ ધર્મ અધર્મ આકાસ કાલ,  
     પુદ્ગલ જીવ સબ મેરો રૂપ જગમૈં।  
 જાનૈ ન મરમ નિજ માનૈ આપા પર વસ્તુ,  
     બાંધૈ દ્રિઢ કરમ ધરમ ખોવૈ ડગમૈં॥  
 સમકિતી જીવ સુદ્ધ અનુભૌ અભ્યાસૈ તાતૈં,  
     પરકૌ મમત્વ ત્યાગ કરૈ પગ પગમૈં।  
 અપને સુભાવમૈં મગન રહૈ આઠો જામ,  
     ધારાવાહી પંથક કહાવૈ મોખ મગમૈં॥૧૮॥

શાસ્ત્રાર્થ :-દ્રિઢ=પાકા. ધર્મ=પદાર્થનો નિજસ્વભાવ. ડગ=કંદમ. જામ=પ્રહર. આઠોં  
 જામ=હમેશાં. પંથક=મુસાફર.

અર્થ :-કોઈ બ્રહ્મ અદૈતવાદી મૂર્ખ કહે છે કે ધર્મ-અધર્મ-આકાશ-કાળ-પુદ્ગલ  
 અને જીવ આ સર્વે જગત જ મારું સ્વરૂપ છે, અર્થાત્ સર્વ દ્રવ્યમય બ્રહ્મ છે, તેઓ  
 પોતાનું નિજ સ્વરૂપ જાણતા નથી અને પર-પદાર્થોને નિજ-આત્મા માને છે, તેથી તેઓ  
 સમયે સમયે કર્માનો દૃઢ બંધન કરીને પોતાનું સ્વરૂપ મળિન કરે છે. પણ સમ્યજ્ઞાની  
 જીવ શુદ્ધ આત્મ-અનુભવ કરે છે, તેથી ક્ષણે-ક્ષણે પર પદાર્થોમાંથી મમત્વ દૂર કરે છે  
 અને મોક્ષમાર્ગના ધારાપ્રવાહી પથિક કહેવાય છે. ૧૮.

સાતમા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન (સવૈયા એકગ્રીસા)  
 કોઊ સઠ કહૈ જેતૌ ઝેયરૂપ પરવાંન,  
     તેતૌ ગ્યાન તાતૈં કહૂં અધિક ન ઔર હૈ।

સર્વદ્રવ્યમયં પ્રપદ્ય પુરુષં દુર્વાસનાવાસિત:  
 સ્વદ્રવ્યભ્રમત: પશુ: કિલ પરદવ્યેશુ વિશ્રામ્યતિ।  
 સ્યાદાદી તુ સમસ્તવસ્તુષુ પરદવ્યાત્મના નાસ્તિતાં  
     જાનનિર્મલશુદ્ધબોધમહિમા સ્વદ્રવ્યમેવાશ્રયેત् ॥૭॥  
 ભિન્નક્ષેત્રનિષ્ણણબોધનિયતવ્યાપારનિષ્ઠ: સદા  
     સીદત્વેવ બહિ: પતન્તમભિત: પશ્યન્યુમાંસં પશુઃ।  
 સ્વક્ષેત્રાસ્તિતયા નિરુદ્ધરભસ: સ્યાદાદવેદી પુન-  
     સ્તિષ્ઠત્વાત્મનિખાતબોધનિયતવ્યાપારશક્તિર્ભવન् ॥૮॥

તિહું કાલ પરક્ષેત્રવ્યાપી પરનયૌ માનૈ,  
આપા ન પિછાનૈ એસી મિથ્યાદૃગ દૌર હૈ॥  
જૈનમતી કહૈ જીવ સત્તા પરવાંન ગ્યાન,  
જ્ઞેયસૌં અવ્યાપક જગત સિરમૌર હૈ।  
ગ્યાનકી પ્રભામૈં પ્રતિબિંબિત વિવિધ જ્ઞેય,  
જદપિ તથાપિ થિતિ ન્યારી ન્યારી ઠૈર હૈ॥૧૯॥

શાસ્ત્રાર્થ :-દૌર=ભટકવું. સિરમૌર=પ્રધાન. થિતિ=સ્થિતિ.

અર્થ :-કોઈ મૂર્ખ કહે છે કે જેટલું નાનું અથવા મોટું જ્ઞેયનું સ્વરૂપ હોય છે, તેટલું જ શાન હોય છે, તેનાથી વધતું-ઓછું નથી હોતું. આ રીતે તેઓ સદૈવ શાનને પરક્ષેત્ર વ્યાપી અને જ્ઞેય સાથે તન્મય માને છે, તેથી કહેવું જોઈએ કે તેઓ આત્માનું સ્વરૂપ સમજી શક્યા નથી, મિથ્યાત્વની એવી જ ગતિ છે. તેમને સ્વાધ્યાદી જૈની કહે છે કે શાન આત્મસત્તા બરાબર છે, તે ઘટ-પટાદિ જ્ઞેય સાથે તન્મય થતું નથી, શાન જગતનો ચૂડામણિ છે, તેની પ્રભામાં જોકે અનેક જ્ઞેય પ્રતિબિંબિત થાય છે તોપણ બનેની સત્તાભૂમિ જુદી જુદી છે. ૧૮.

આઠમાં પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન (સવૈયા એકગ્રીસા)

કોઝ સુંનવાદી કહૈ જ્ઞેયકે વિનાસ હોત, i.e.

ગ્યાનકૌ વિનાસ હોડ કહૌ કેસે જીજિયે।  
તાતે જીવતવ્યતાકી થિરતા નિમિત્ત સબ,  
જ્ઞેયાકાર પરિનામનિકૌ નાસ કીજિયે॥  
સત્યવાદી કહૈ ભૈયા હૂજે નાંહિ ખેદગિન્ન,  
જ્ઞેયસૌ વિરચિ ગ્યાન ભિન્ન માનિ લીજિયે।

સ્ક્ષેત્રસ્થિતયે પૃથગ્વિધપરક્ષેત્રસ્થિતાર્થોજ્ઞનાત्  
તુચ્છીભૂય પશુઃ ગ્રણશ્યતિ ચિદાકારાન् સહાર્થેર્વમન् ।  
સ્વાધ્યાદી તુ વસન્ સ્વધામનિ પરક્ષેત્રે વિદનાસ્તિતાં  
ત્વત્કાર્થોપિ ન તુચ્છતામનુભવત્યાકારકર્ણી પરાન् ॥૧૯॥

ગ્યાનકી સકતિ સાધિ અનુભૌ દસ અરાધિ,  
કરમકૌં ત્યાગિકૈ પરમ રસ પીજિયે ॥૨૦॥

શાદ્વાર્થ :—જજિયે=જીવવું ? ખેદભિન્ન=દુઃખી. વિરચિ=વિરક્તિ થઈને. અરાધિ=આરાધના કરીને. સત્યવાદી=પદાર્થના યથાર્થ સ્વરૂપનું કરનાર.

અર્થ :—કોઈ કોઈ શૂન્યવાદી અર્થાત્ નાસ્તિક કહે છે, જોયનો નાશ થવાથી જ્ઞાનનો નાશ સંભવ છે અને જ્ઞાન જીવનું સ્વરૂપ છે, તેથી જ્ઞાનનો નાશ થવાથી જીવનો નાશ થાય છે તે સ્પષ્ટ છે, તો પછી એવી દશામાં કેવી રીતે જીવન રહી શકે ? માટે જીવની નિત્યતા માટે જ્ઞાનમાં જોયાકાર પરિણમનનો અભાવ માનવો જોઈએ. ત્યાં સત્યવાદી જ્ઞાની કહે છે કે ભાઈ ! તમે વ્યાકુળ ન થાવ, જોયથી ઉદાસીન થઈને જ્ઞાનને તેનાથી ભિન્ન માનો, તથા જ્ઞાનની જ્ઞાયકશક્તિ સિદ્ધ કરીને અનુભવનો અભ્યાસ કરો અને કર્મબંધનથી મુક્ત થઈને પરમાનંદમય અમૃતરસનું પાન કરો. ૨૦.

નવમા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન (સવૈયા એકબ્રીસા)

કોઊ ક્રૂર કહૈ કાયા જીવ દોઊ એક પિંડ,  
જબ દેહ નસૈગી તવહી જીવ મરૈગૌ ।  
  
છાયાકૌસૌ છલ કિધૌં માયાકૌસૌ પરપંચ,  
કાયામૈં સમાઇ ફિરિ કાયાકૌ ન ધરેગૌ ॥  
  
સુધી કહૈ દેહસૌં અવ્યાપક સદીવ જીવ,  
સમૈ પાઇ પરકૌ મમત્વ પરિહરૈગૌ ।  
  
અપને સુભાઈ આઇ ધારના ધરામૈં ધાઇ,  
આપમૈં મગન હૈકૈ આપ સુદ્ધ કરૈગૌ ॥૨૧॥

પૂર્વાલઘિતબોધનાશસમયે જ્ઞાનસ્ય નાશં વિદન्  
સીદત્યેવ ન કિંચનાપિ કલયન્નત્યન્તતુછઃ પશુઃ ।  
અસ્તિત્વં નિજકાલતોઽસ્ય કલયન્ સ્યાદ્વાવેદી પુનઃ  
પૂર્ણસ્તિષ્ઠતિ બાહ્યવસ્તુષુ મુહુર્ભૂત્વા વિનશયત્સ્વપિ ॥૧૦॥

શાદ્વાર્થ :—કૂર=મૂર્ખ. પરપંચ=ઠગાઈ. સુધી=સમ્યગ્જ્ઞાની. પરિહરેગૌ=છોડશે.  
ધરા=ધરતી.

અર્થ :—કોઈ કોઈ મૂર્ખ ચાર્વાક કહે છે કે શરીર અને જીવ બત્તેનો એક પિંડ છે, એટલે જ્યારે શરીર નાશ પામશે ત્યારે જીવ પણ નાશ પામી જશે; જેવી રીતે વૃક્ષનો નાશ થવાથી છાયાનો નાશ થઈ જાય છે, તેવી જ રીતે શરીરનો નાશ થવાથી જીવનો પણ નાશ થઈ જશે. આ ઈન્દ્રિયજ્ઞિયાની માયા સમાન ક્રૌતુક થઈ રહ્યું છે, જીવાત્મા દીપકની જ્યોતના પ્રકાશ સમાન શરીરમાં સમાઈ જશે, પછી શરીર ધારણ નહીં કરે. આ બાબતમાં સમ્યગ્જ્ઞાની કહે છે કે જીવ પદાર્થ શરીરથી સદૈવ ભિન્ન છે, તે કાળજિયિ પામીને પરપદાર્થો પ્રત્યે મમત્વ છોડશે અને પોતાના સ્વરૂપને પ્રામ થઈને નિજાત્મભૂમિમાં વિશ્રાંમ કરીને તેમાં જ લીન થઈને પોતાને પોતે જ શુદ્ધ કરશે. ૨૧.

વળી—(દોહરા)

જ્યો તન કંચુક ત્યાગસોં, વિનસૈ નાંહિ ભુજંગ ।  
ત્યો સરીરકે નાસતૈં, અલખ અખંડિત અંગ ॥૨૨॥

શાદ્વાર્થ :—કંચુક=કાંચણી. ભુજંગ=સાપ. અખંડિત=અવિનાશી.

અર્થ :—જેવી રીતે કાંચણીનો ત્યાગ કરવાથી સાપ નાશ પામતો નથી, તેવી જ રીતે શરીરનો નાશ થવાથી જીવ પદાર્થ નાશ પામતો નથી. ૨૨.

દસમા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન (સર્વૈયા એકબીસા)

કોऊ દુરબુદ્ધિ કહૈ પહલે ન હુતૌ જીવ,  
      દેહ ઉપજત અબ ઉપજ્યૌ હૈ આઇકે ।  
જૌલો દેહ તૌલો દેહધારી દેહ નસૈ,  
      રહૈગી અલખ જોતિ જોતિમે સમાઇકે ॥

અર્થાલમ્બનકાલ એવ કલયન્ જ્ઞાનસ્ય સત્ત્વं બહિ-  
      ઝેયાલમ્બનલાલસેન મનસા બ્રાષ્યન્ પશુર્નશ્યતિ ।  
નાસ્તિત્વં પરકાલતોઽસ્ય કલયન્ સ્યાદ્વાદવેદી પુન-  
      સ્તિષ્ઠત્વાત્મનિખાતનિત્યસહજજાનૈકપુંજીભવન્ ॥૧૧॥

સદબુદ્ધી કહૈ જીવ અનાદિકૌ દેહધારી,  
જબ ગ્યાની હોઇગૌ કવહું કાલ પાઇકે।  
તબહીસોં પર તજિ અપનો સરૂપ ભજિ,  
પાવૈગી પરમપદ કરમ નસાઇકે ॥૨૩॥

**અર્થ :**—કોઈ કોઈ મૂર્ખ કહે છે કે પહેલાં જીવ ન હતો, પૃથ્વી, જળ, અઞ્જિ, વાયુ અને આકાશ—આ પાંચ તત્ત્વમય શરીર ઉત્પત્ત થતાં શાન-શક્તિરૂપ જીવ ઉપજે છે, જ્યાંસુધી શરીર રહે છે ત્યાંસુધી જીવ રહે છે અને શરીરનો નાશ થતાં જીવાત્માનો પ્રકાશ પ્રકાશમાં સમાઈ જાય છે. આ વિષયમાં સમ્યજ્ઞાની કહે છે કે જીવ પદાર્થે અનાદિકાળથી દેહ ધારણ કરેલ છે, જીવ નવો ઉપજતો નથી અને ન દેહનો નાશ થવાથી તે નાશ પામે છે. કોઈવાર અવસર પામીને જ્યારે શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરશે, ત્યારે પરપદાર્થોમાં અહંબુદ્ધિ છોડીને આત્મસ્વરૂપનું ઘેરણ કરશે અને આઠ કર્મોનો નાશ કરીને નિર્વાણપદ પામશે. ૨૩.

અગિયારમાં પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન

(સવૈયા એકબીસા)

કોઊ પક્ષપાતી જીવ કહૈ જ્ઞેયકે અકાર,  
પરિનયૌ ગ્યાન તાતેં ચેતના અસત હૈ ।  
જ્ઞેયકે નસત ચેતનાકૌ નાસ તા કારન,  
આત્મા અચેતન ત્રિકાલ મેરે મત હૈ ॥  
પંડિત કહત ગ્યાન સહજ અખંડિત હૈ,  
જ્ઞેયકૌ આકાર ધરૈ જ્ઞેયસોં વિરત હૈ ।

વિશ્રાત્ત: પરભાવભાવકલનાન્નિત્યં બહિર્સ્તુષુ  
નશ્યત્યેવ પશુ: સ્વભાવમહિમન્યેકાન્તનિશ્ચેતન:  
સર્વસ્માન્યિતસ્વભાવભવનજ્ઞાનાદ્વિભક્તો ભવન્  
સ્યાદ્વારી તુ ન નાશમેતિ સહજસ્પષ્ટીકૃતપ્રત્યય: ॥૧૨॥

ચેતનાકૌ નાસ હોત સત્તાકૌ વિનાસ હોઇ,  
યાતેં ગ્યાન ચેતના પ્રવાન જીવ તત હૈ॥૨૪॥

શાસ્ત્રાર્થ :—પક્ષપાતી=હઠાગ્રહી.      અસત=સત્તા.      રહિત.      સહજ=સ્વાભાવિક.  
વિરત=વિરકૃત. તત=તત્ત્વ.

અર્થ :—કોઈ હઠાગ્રહી કહે છે કે શૈયના આકારે જ્ઞાનનું પરિણમન થાય છે અને જ્ઞાનાકાર પરિણમન અસત્ત છે, તેથી ચેતનાનો અભાવ થયો, શૈયોનો નાશ થવાથી ચેતનાનો નાશ થાય છે, તેથી મારા સિદ્ધાંતમાં આત્મા સદા અચેતન છે. આમાં સ્યાદ્વાદી જ્ઞાની કહે છે કે જ્ઞાનસ્વભાવથી જ અવિનાશી છે, તે શૈયાકાર પરિણમન કરે છે પરંતુ શૈયથી બિના છે, જો જ્ઞાનચેતનાનો નાશ માનશો તો આત્મસત્તાનો નાશ થઈ જશે, તેથી જીવતત્ત્વને જ્ઞાનચેતનાયુક્ત માનવું તે સમ્યજ્ઞાન છે. ૨૬૪.

ભારમા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન  
(સવૈયા એકત્રીસા)

કોઊ મહામૂર્ખ કહત એક પિંડ માંહિ,  
જહાંલોં અચિત ચિત અંગ લહલહૈ હૈ।  
જોગરૂપ ભોગરૂપ નાનાકાર જ્ઞેયરૂપ,  
જેતે ભેદ કરમકે તે તે જીવ કહૈ હૈ॥  
મતિમાન કહૈ એક પિંડ માંહિ એક જીવ,  
તાહીકે અનંત ભાવ અંસ ફેલિ રહે હૈ।  
પુગલસોં ભિન્ન કર્મજોગસોં અખિન્ન સદા,  
ઉપજૈ વિનસૈ થિરતા સુભાવ ગહૈ હૈ॥૨૫॥

અધ્યાસ્યાત્મનિ સર્વભાવભવનં શુદ્ધસ્વભાવચ્યુત:  
સર્વત્રાધ્યાનિવારિતો ગતભય: સ્વૈરં પશુ: ક્રીડતિ।  
સ્યાદ્વાદી તુ વિશુદ્ધ એવ લસતિ સ્વસ્ય સ્વભાવં ભરા-  
દાસ્થ:      પરભાવભાવવિરહબ્યાલોકનિષ્કમ્પિત: ॥૧૩॥

શાલાર્થ :—અચિત=અચેતન-જડ. ચિત=ચેતન. મતિમાન=બુદ્ધિમાન—સમ્યગજ્ઞાની.

અર્થ :—કોઈ કોઈ મૂર્ખ કહે છે કે એક શરીરમાં જ્યાંસુધી ચેતન-અચેતન પદાર્થોનાં તરંગ ઉઠે છે, ત્યાંસુધી જે જોગરૂપ પરિણામે તે જોગી જીવ અને જે ભોગરૂપ પરિણામે તે ભોગી જીવ છે, આવી રીતે જોગરૂપ ક્રિયાના જેટલા ભેદ થાય છે, જીવના તેટલા ભેદ એક દેહમાં ઉપજે છે તેથી આત્મસત્તાના અનંત અંશ થાય છે. તેમને સમ્યગજ્ઞાની કહે છે કે એક શરીરમાં એક જ જીવ છે, તેના જ્ઞાનગુણના પરિણામનથી અનંત ભાવરૂપ અંશ પ્રગટ થાય છે. આ જીવ શરીરથી બિના છે, કર્મસંયોગથી રહિત છે અને સદા ઉત્પાદ-વ્યય-ધૌષ્ય ગુણ-સંપત્તિ છે. ૨૫.

તેરમા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન (સવૈયા એકત્રીસા)

કોऊ એક છિનવાદી કહૈ એક પિંડ માંહિ,  
 એક જીવ ઉપજત એક વિનસત હૈ।  
 જાહી સમૈ અંતર નવીન ઉત્પત્તિ હોડી,  
 તાહી સમૈ પ્રથમ પુરાતન બસત હૈ॥  
 સરવાંગવાદી કહૈ જૈસે જલ વસ્તુ એક,  
 સોઈ જલ વિવિધ તરંગનિ લસત હૈ।  
 તૈસે એક આત્મ દરબ ગુન પરજૈસોં,  
 અનેક ભયૌ પૈ એકરૂપ દરસત હૈ॥૨૬॥

શાલાર્થ :—સરવાંગવાદી=અનેકાંતવાદી. તરંગનિ=લહેરો.

અર્થ :—કોઈ કોઈ ક્ષણિકવાદી—બૌદ્ધ કહે છે કે એક શરીરમાં એક જીવ ઉપજે છે અને એક નાશ પામે છે, જે ક્ષણે નવો જીવ ઉત્પત્ત થાય છે તેના પહેલાના સમયમાં પ્રાચીન જીવ હતો. તેમને સ્યાદ્વાદી કહે છે કે જેવી રીતે પ્રાણી એક પદાર્થ છે તે જ

પ્રાદુર્ભાવવિરામમુદ્રિતવહજ્ઞાનાંશનાનાત્મના  
 નિર્જાનાત્કણભંગસંગપતિતઃ પ્રાયઃ પશુનશ્યતિ।  
 સ્યાદ્વાદી તુ ચિદાત્મના પરિમૃશ્યશ્વિદ્વસ્તુ નિત્યોદિતં  
 ટંકોત્કીર્ણઘનસ્વભાવમહિમ જ્ઞાનં ભવન્ જીવતિ॥૧૪॥

અનેક લહેરરૂપ થાય છે, તેવી જ રીતે આત્મદ્રવ્ય પોતાના ગુણ-પર્યાયોથી અનેકરૂપ થાય છે, પણ નિશ્ચયનયથી એકરૂપ દેખાય છે. ૨૬.

ચૌદમા પક્ષનંસુધી સ્પષ્ટીકરણ અને ખંડન

(સ્વૈચ્છા એકત્રીસા)

કોઊ બાલબુદ્ધિ કહૈ ગ્યાયક સકતિ જૌલોં,  
તૌલોં ગ્યાન અસુદ્ધ જગત મધ્ય જાનિયૈ।  
જ્ઞાયક સકતિ કાલ પાઇ મિટિ જાઇ જવ,  
તવ અવિરોધ બોધ વિમલ બખાનિયૈ॥  
પરમ પ્રવીન કહૈ એસી તૌ ન બનૈ બાત,  
જૈસેં બિન પરગાસ સૂરજ ન માનિયે।  
તૈસેં બિન ગ્યાયક-સકતિ ન કહાવૈ ગ્યાન  
યહ તૌ ન પરોચ્છ પરતચ્છ પરપવાંનિયૈ॥૨૭॥

**શાબ્દાર્થ :**—બાલબુદ્ધિ=અજ્ઞાની. પરમ પ્રવીન=સમ્યગજ્ઞાની. પરગાસ (પ્રકાશ)=અજ્વાળું.  
પરતચ્છ=સાક્ષાત्.

**અર્થ :**—કોઈ કોઈ અજ્ઞાની કહે છે કે જ્યાં સુધી જ્ઞાનમાં જ્ઞાયકશક્તિ છે ત્યાંસુધી તે જ્ઞાન સંસારમાં અશુદ્ધ કહેવાય છે; ભાવ એ છે કે જ્ઞાયક-શક્તિનો દોષ છે અને જ્યારે સમય પામીને જ્ઞાયક શક્તિ નાચ થઈ જાય છે ત્યારે જ્ઞાન નિર્વિકલ્પ અને નિર્મળ થઈ જાય છે. ત્યાં સમ્યગજ્ઞાની કહે છે કે આ વાત અનુભવમાં આવતી નથી, કેમકે જેવી રીતે પ્રકાશ વિના સૂર્ય હોતો નથી તેવી જ રીતે જ્ઞાયકશક્તિ વિના જ્ઞાન હોઈ શકતું નથી. તેથી તમારો પક્ષ પ્રત્યક્ષ પ્રમાણથી બાધિત છે. ૨૭.

ટંકોલીર્ણવિશુદ્ધબોધવિસરાકારાત્મતત્ત્વાશયા  
વાંછત્યુછ્છલદચ્છવિત્પરિણતેર્ભિન્ન પશુ: કિંચન ।  
જ્ઞાન નિત્યમનિત્યતાપરિગમેઽપ્યાસાદયત્યુજ્જ્વલં  
સ્થાદ્વારી તદનિત્યતાં પરિમૃશંશિદ્ધસ્તુવૃત્તિક્રમાત् ॥૧૫॥

સ્યાદ્વાદની પ્રશંસા (દોહરા)

ઇહિ વિધિ આતમ ગ્યાન હિત, સ્યાદવાદ પરવાંન ।  
 જાકે વચન વિચારસૌં, મૂર્ખ હોઇ સુજાન ॥૨૮॥  
 સ્યાદવાદ આતમ દશા, તા કારન બલવાન ।  
 સિવસાધક બાધા રહિત, અખે અખંડિત આન ॥૨૯॥

**અર્થ :**—આ રીતે આત્મજ્ઞાન માટે સ્યાદ્વાદ જ સમર્થ છે, એના વચનો સાંભળવાથી અને એનું અધ્યયન કરવાથી અજ્ઞાનીઓ પંડિત બની જાય છે. ૨૮. સ્યાદ્વાદથી આત્માનું સ્વરૂપ ઓળખાય છે, તેથી આ જ્ઞાન બહુ બળવાન છે, મોક્ષનું સાધક છે, અનુમાન-પ્રમાણથી બાધારહિત છે, અક્ષય છે, એને આજ્ઞાવાદી પ્રતિવાદી ખંડિત કરી શકતા નથી. ૨૯.

### અગ્નિયાર્થમા અધિકારનો સાર

જૈનધર્મના મહત્વપૂર્ણ અનેક સિદ્ધાંતોમાં સ્યાદ્વાદ મુખ્ય છે, જૈનધર્મનું જે કંઈ ગૌરવ છે, તે સ્યાદ્વાદનું છે. આ સ્યાદ્વાદ અન્ય ધર્મોને નિર્મૂળ કરવા માટે સુદર્શન-ચક્ર સમાન છે. આ સ્યાદ્વાદનું રહસ્ય સમજવું કઠિન નથી. પરંતુ ગૂઢ અવશ્ય છે એને એટલું ગૂઢ છે કે એને સ્વામી શંકરાચાર્ય અથવા સ્વામી દ્યાનાંદ સરસ્વતી જેવા અજૈન વિદ્વાનો સમજ શક્યા નહીં અને સ્યાદ્વાદનું ઉલટું ખંડન કરીને જૈનધર્મને મોટો ધક્કો પહોંચાડી ગયા. એટલું જ નહીં, કેટલાક આધુનિક વિદ્વાનો આ ધર્મ ઉપર નાસ્તિકપણાનું લાંઘન લગાડે છે.

પદાર્થમાં જે અનેક ધર્મો હોય છે, તે બધા એક સાથે કહી શકતા નથી, કેમકે શબ્દમાં એટલી શક્તિ નથી કે જે અનેક ધર્મોને એકસાથે કહી શકે, તેથી કોઈ એક

ઇત્યજ્ઞાનવિમૂળાનાં જ્ઞાનમાત્રં પ્રસાધયન् ।  
 આત્મતત્ત્વમનેકાન્તઃ સ્વયમેવાનુભૂયતે ॥૧૬॥  
 એવं તત્ત્વવ્યવસ્થિત્યા સ્વં વ્યવસ્થાપયન् સ્વયમ् ।  
 અલંઘં શાસનं જૈનમનેકાન્તો વ્યવસ્થિતઃ ॥૧૭॥

ધર્મને મુખ્ય અને બાકીનાને ગૌણ કરીને કથન કરવામાં આવે છે.  
‘સ્વામીકાર્તિક્યાનુપ્રેક્ષા’માં કહ્યું છે :—

ણાણાધ્રમજુદં પિ ય એયં ધર્મં પિ વચ્ચદે અત્યં।  
તસ્સેયવિવક્ખાદો ણાથિ વિવક્ખાહુ સેસાણં ॥૨૬૪॥

અર્થ :—તેથી જે ધર્મનું જે અપેક્ષાએ કથન કરવામાં આવ્યું હોય તે ધર્મ, જે શબ્દથી કથન કરવામાં આવ્યું હોય તે શબ્દ, અને તેને જાણનાર જ્ઞાન—એ ત્રણે નય છે. કહ્યું પણ છે કે :—

સો ચિય ઇકો ધર્મો વાચસયદો વિ તસ્સ ધમસ્સ।  
તં જાણદિ તં ણાણં તે તિળણ વિણ્ય વિસેસા ય ॥

અર્થ :—આપણી નિત્યની વાતચીત પણ નયગર્ભિત હોય છે, જેમકે જ્યારે કોઈ મરણ-સન્પુખ હોય છે ત્યારે તેને હિંમત આપવામાં આવે છે કે જીવ નિત્ય છે, જીવ તો મરતો નથી, શરીરરૂપ વચ્ચનો તેની સાથે સંબંધ છે, તેથી વચ્ચ સમાન શરીર બદલવું પડે છે. ન તો જીવ જન્મે છે, ન મરે છે અને ન ધન, સંતાન, કુટુંબ આદિ સાથે તેમનો સંબંધ છે. આ જે કાંઈ કહેવામાં આવ્યું છે તે જીવ પદાર્થ નિત્યધર્મ તરફ દાખિ રાખીને કહેવામાં આવ્યું છે. પછી જ્યારે તે મરી જાય છે અને તેના સંબંધીઓને સંબોધન કરે છે ત્યારે કહે છે કે સંસાર અનિત્ય છે, જે જન્મે છે તે મરે જ છે, પર્યાયોનું પલટવું એ જીવનો સ્વભાવ જ છે, આ કથન પદાર્થના અનિત્ય ધર્મ તરફ દાખિ રાખીને કહ્યું છે. કુંદકુંદસ્વામીએ પંચાસ્તિકાયમાં આ વિષયને ખૂબ સ્પષ્ટ કરેલ છે. સ્વામીજીએ કહ્યું છે કે જીવના ચેતના, ઉપયોગ આદિ ગુણ છે, નર, નારક આદિ પર્યાયો છે. જ્યારે કોઈ જીવ મનુષ્ય પર્યાયમાંથી દેવ પર્યાયમાં જાય છે ત્યારે મનુષ્ય પર્યાયનો અભાવ (વ્યય) અને દેવ પર્યાયનો સદ્ભાવ (ઉત્પાદ) થાય છે, પરંતુ જીવ ન ઉપજ્યો છે કે ન મર્યાદા છે, આ તેનો ધ્રુવ ધર્મ છે. બસ! આનું જ નામ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય છે.

સો ચેવ જાદિ મરણ જાદિ ણ ણદ્વો ણ ચેવ ઉપ્ણણો।  
ઉપ્ણણો ય વિણદ્વો દેવો મણુસુત્તિ પજ્ઞાઓ ॥૧૮॥

(પંચાસ્તિકાય પૃ. ૩૮)

અર્થ :—તે જ જીવ ઉપજે છે કે જે મરણને પ્રાત થાય છે, સ્વભાવથી તે જીવ ન વિનાશ પામ્યો છે અને નિશ્ચયથી ન ઉપજ્યો છે, સદા એકરૂપ છે. ત્યારે કોણ ઉપજ્યું અને કોણ વિષસ્યું છે? પર્યાય જ ઉપજી છે અને પર્યાય જ વિષસી છે. જેમ કે દેવ પર્યાય ઉત્પત્ત થઈ છે, મનુષ્ય પર્યાય નાશ પામી છે, એ પર્યાયનો ઉત્પાદ-વ્યય છે. જીવને પ્રૌબ્ધ જાણવો.

એવं ભાવમભાવं ભાવભાવं અભાવભાવं ચ।  
ગુણપञ્ચયેહિં સહિદો સંસરમાણો કુણદિ જીવો ॥૨૧॥

(પંચાસ્તિકાય પૃ. ૪૫)

અર્થ :—પર્યાયાર્થિક નયની વિવક્ષાથી પંચપરાવર્તનરૂપ સંસારમાં ભ્રમણ કરતો આ આત્મા દેવાદિ પર્યાયોને ઉત્પત્ત કરે છે, મનુષ્યાદિ પર્યાયોનો નાશ કરે છે, તથા વિદ્યમાન દેવાદિ પર્યાયોના નાશનો આરંભ કરે છે અને જે વિદ્યમાન નથી તે મનુષ્યાદિ પર્યાયના ઉત્પાદનો આરંભ કરે છે.

ખૂબ યાદ રાખવું કે નયનું કથન અપેક્ષિત હોય છે અને ત્યારે જ તે સુનય કહેવાય છે, જો અપેક્ષારહિત કથન કરવામાં આવે તો તે નય નથી, કુનય છે.

તે સાવવિક્ખા સુણયા ગિરવિક્ખા તે વિ દુણયા હોંતિ।

સયલવવહારસિદ્ધી સુણયાદો હોદિ ણિયમેણ ॥

અર્થ :—આ નય પરસ્પર અપેક્ષા સહિત હોય ત્યારે તો સુનય છે અને તે જ જ્યારે અપેક્ષારહિત લેવામાં આવે ત્યારે દુર્નય છે. સુનયથી સર્વ વ્યવહારની સિદ્ધિ થાય છે.

અન્ય મતાવલંબી પણ જીવ પદાર્થના એક જ ધર્મ ઉપર દટ્ઠિ રાખીને મસ્ત થઈ ગયા છે, તેથી જૈનમતમાં તેમને ‘મતવાળા’<sup>૧</sup> કહ્યા છે. આ અધિકારમાં ચૌદમતવાળાઓને સંબોધન કર્યું છે અને એમના માનેલા પ્રત્યેક ધર્મનું સમર્થન કરતાં સ્યાદ્વાને પુષ્ટ કરેલ છે.

